

RAN-2408000602060007
F.Y.B.Com. Examination March - 2026
Sec-1 : Financial Management (Paper-II)

[Total Marks: 25]

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book.	Seat No.: <table style="width: 100%; text-align: center;"> <tr> <td style="border: 1px solid black; width: 20px; height: 20px;"></td> <td style="border: 1px solid black; width: 20px; height: 20px;"></td> <td style="border: 1px solid black; width: 20px; height: 20px;"></td> <td style="border: 1px solid black; width: 20px; height: 20px;"></td> <td style="border: 1px solid black; width: 20px; height: 20px;"></td> <td style="border: 1px solid black; width: 20px; height: 20px;"></td> </tr> </table> Student's Signature						

- પ્ર-1. ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ પાંચ) 10**
- 1) વોલ્ટરના મોડેલમાં ડિક્લાઈનિંગ ફર્મ્સનો અર્થ આપો.
 - 2) વચગાળાનું ડિવિડન્ડ એટલે શું?
 - 3) અનિયમિત ડિવિડન્ડનીતિ એટલે શું?
 - 4) લેણાં સંચાલનનાં હેતુઓ જણાવો.
 - 5) કુલ (ગ્રોસ) કાર્યશીલ મૂડીનો અર્થ આપો.
 - 6) કાર્યશીલ મૂડીના ઘટકો જણાવો.
 - 7) નિયમિત કાર્યશીલ મૂડી એટલે શું?
- પ્ર-2. કાર્યશીલમૂડીની જરૂરીયાતને અસર કરતા વિવિધ પરિબળો ચર્ચો. 15**
- અથવા**
- પ્ર-2. અ) આગોર્ડનનું ડિવિડન્ડમૂડીકરણ મોડલ વિગતવાર સમજાવો. 10**
- બ) ABC લિમિટેડ જોખમ વર્ગ સાથે સંબંધિત છે જેના માટે યોગ્ય મૂડીકરણ દર 10% છે. તેની 05**
 પાસે હાલમાં રૂ.100 ના ભાવે 50,000 શેર બાકી છે. કંપની રૂ.6 શેરદીઠ ના ડિવિડન્ડની જાહેરાત
 પર વિચાર કરી રહી છે. જો ડિવિડન્ડ ચૂકવવામાં આવે અને જો તે ચૂકવવામાં ન આવે તોવર્ષના
 અંતે શેરની કિંમતની ગણતરી કરો.

ENGLISH VERSION

- Q-1. Write answer in short (Any five) 10**
- 1) State the meaning of Declining firms under Walter Model.
 - 2) What is interim dividend?
 - 3) What is irregular dividend policy?
 - 4) State the objectives of receivables management.
 - 5) Give the meaning of Gross working capital.
 - 6) State the components of working capital.
 - 7) What is regular working capital?

Q-2. Discuss the various factors affecting working capital requirements. **15**

OR

Q-2. A) Explain Gordon's dividend capitalization model in detail. **10**

B) ABC Ltd. Belongs to a risk class for which appropriate capitalisation rate is 10%. **05**
It has currently 50,000 shares outstanding selling at Rs. 100 each. The firm is contemplating the declaration of dividend at Rs. 6 per share. Calculate the price of share at the end of year if dividend is paid and if it is not paid.
